

17. સુગંધ કર્યાની ...!



ડૉ. દર્શના ધોળકીયા

જન્મ : 11 - 01- 1962

ડૉ. દર્શના ચમનલાલ ધોળકીયાનો જન્મ કર્યા જિલ્લાના ભુજમાં થયો છે. તેમણે 'નરસિંહ ચરિત્રવિર્મર્શ', 'મહાભારત ચરિત્રવિર્મર્શ', 'આઠે પહોર આનંદ રે', 'પરિચયપર્વ' જેવાં ચૌદેક પુસ્તકો લખ્યાં છે. હાલ તેઓ કર્યા યુનિવર્સિટીમાં ભાષાભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે. 'ડૉ. જયંત ખર્ચી- બુલ્લેશ પારિતોષિક', 'ડૉ. પ્રમોદકુમાર પટેલ વિવેચન પારિતોષિક' તેમને ગ્રાપ થયાં છે.

આ એકમમાં પત્રના માધ્યમથી કર્યાનાં જોવાલાયક સ્થળોની માહિતીનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે. કર્યાની ભૌગોલિક સ્થિતિ પણ સુંદર રીતે આલેખી છે. પ્રસ્તુત એકમ આપણને કર્યાની વિશેષતાઓનો પરિચય કરાવે છે.

ડૉ. દર્શના ધોળકીયા

ન્યુ મિન્ટ રોડ,
પોરિસ બેકરી પાસે,
ભુજ-કર્યા

તા. 12-7-2011

ધ્રિય સૌમિત્રિ,

મોટી બહેનનું ખૂબ વહાલ.

થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાં...બા વેકેશનની યાદ છજુ પણ તને સત્તાવતી હશે, ખરુંને ? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્યનિક પ્રવાસનાં સ્વખાં તારી રાત્રિને મીઠી બનાવતાં હશે.

હા, જો એ સંદર્ભમાં જ મને સૂઝાયું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કર્યાના પ્રવાસે આવીને આપણા કર્યાની ભૂમિનો, તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું ? ચાલ, તને એવું મન થાય એ માટે આપણે કર્યાની વાતો કરીએ.

તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં ? અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો. હજુ હમજાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો, સજારૂપ લાગે તેવો, પ્રદેશ હતો. પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યો, એમને સત્ય સમજાયું. એ સૌ કચ્છપ્રદેશના પ્રેમમાં પડી ગયાં ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે-જાણો એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ.

ભાઈ સૌમિત્રિ, કેવો છે આપણો આ પ્રદેશ ? ‘ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી’ જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પણ્ણિમ ભારતનું પ્રવેશદ્વાર ગણાતું. સમુક્ર, રણ અને પર્વતથી વીટળાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે.

કચ્છપ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતનાય સૌથી બીજા નંબરના મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પણ્ણિમ ફરતાં ફુલ નવ કલાક જેવો સમય લાગે છે.

કચ્છમાં બે રણ છે : નાનું અને મોટું. આ રણની વિશેષતા શી, ખબર છે ? એમાં દેખીતી રીતે ક્યાંય રણનાં લક્ષણો નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે. આખી દુનિયાનાં રણથી આપણું રણ એ રીતે જુદું પડે છે. અહીં વર્ષમાં આઠ મહિના દરિયાનું પાણી હોય છે ને ચાર મહિના આ રણ સુકાયેલું હોય છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજભારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું કચ્છ નામ પડ્યું એવી માન્યતા છે. ભૂસ્તરીય હળનચલનથી કચ્છની ભરતી સમુક્તતા પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો.

કચ્છની ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અભાત છે. દક્ષિણ-પણ્ણિમ અને પણ્ણિમે અરબી સમુક્ર ઘૂઘવે છે.

કચ્છમાં ખડીર એક એવો ભાગ છે, જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ રણમાં પાણી ભરાયેલું રહે છે. ખડીરબેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. ઈ.સ. 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતાત્ત્વીય પુરાવા મળ્યા ને ખોદકામ કરતાં જમીનમાંથી સમગ્ર નગરરચનાની વિશાળતા જોવા મળી. જે હડપીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે.

કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણપ્રસિદ્ધ અડસઠ તીર્થધામમાં ગણાતું નારાયણસરોવર આવેલું છે, જેની ચારે તરફ સમુક્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. ત્યાંથી બે કિમીના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે.

કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીણોધરનો દુંગર છે, જ્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. તો ઉત્તરે રણના કિનારે કાળો દુંગર બિરાજમાન છે, જ્યાં ગુરુ દત્તાત્રેયનાં પગલાં છે; તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજિયા દુંગર પર. જ્યાં ભુજંગ નાગનું મંદિર છે.

આમ, રણ, દરિયો ને કુંગરની વચ્ચાળે વસેલા કચ્છપ્રદેશને ભદ્રેશ્વર, સુથરી કોઠારા જેવાં સ્થાપત્યનાં ઉત્તમ નમૂના દર્શાવતાં જૈનમંદિરો, રવેચીમાતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવાં અનેક સ્થળો વીટળાયાં છે. કંડલા કચ્છનું મુખ્ય પદ્ધીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગાંધારું નગર.

રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંતકવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે. જેમાં પદ્ધીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે.

તો, વહાલા સૌમિત્રિ, આ છે આપણા પ્રદેશની સુગંધ. તું એ સુગંધ લેવા જલદી-જલદી આવીશને ? રાહ જોઉ છું.

- મોટી બહેનનું વહાલ.

● ટિપ્પણી

કાલ્યનિક કલ્યનાથી ઉત્પન્ન થયેલું, વાસ્તવિક અથવા દુનિયાનું નહિ એવું મોસાળ ‘મા’નું પિયર ધીગી (અહીં) મજબૂત ધોરી મુખ્ય, અહીં બળદના અર્થમાં વિશિષ્ટ વિશેષતા ધરાવતું ન્યારી અનોખી, જુદી બેટ ચારે બાજુ પાણીથી વીટળાયેલી જમીન, દ્વીપ ભૂસરીય પૃથ્વીનું પડ, તેની સપાટી નીચેનો થર ધૂઘવે ગર્જવું તે પ્રસિદ્ધ વિખ્યાત, જાહેર પ્રાકૃતિક કુદરતને લગતું, ભૌતિક તપશ્ચર્યા તપસ્યા, તપ બંદર દરિયા કે નદીકિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન

● ભાષા-સજ્જતા

● પત્ર લેખન ●

પત્ર સરસ રીતે લખવા માટે તેની કેટલીક બાબતો અગત્યની છે, તેની કાળજી લેવી જોઈએ. (1) સરનામું (2) સંબોધન (3) પત્રનું કથન (4) અન્ય સમાચાર (5) સમાપન.

(1) **સરનામું :** પત્ર લખનારે પોતાનું સરનામું પત્રના મથાળે જમણી બાજુ લખવું જોઈએ. તેની નીચે તારીખ લખાય છે. બીજું, જેને પત્ર લખ્યો હોય, તેનું સરનામું તે પોસ્ટકાર્ડ કે અંતર્દીય પત્રમાં ચોક્કસ ખાનામાં લખાય છે. કવરમાં જમણી તરફ ટિકિટની જગ્ગા છોડીને તે લખાય છે. સરનામું એવી રીતે લખવું જોઈએ કે જેથી પત્ર સહેલાઈથી અને ચોક્કસાઈથી મળી જાય. તેમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

1. સરનામું સહેલાઈથી વાંચી શકાય, તેવા અક્ષરોમાં લખેલું હોય.
2. પત્ર જેને મળવાનો હોય, તેનું પૂરું નામ લખવું જોઈએ.
3. પત્ર જે સ્થળે મોકલવાનો હોય, એનો પિનકોડ અવશ્ય લખવો.

નીચે આપેલ સરનામું ધ્યાનથી જુઓ.

શ્રી દુગ્ગનલાલ કેશવલાલ મહેતા
નીલક્ષ્મિલ એપાર્ટમેન્ટ, ભાવનિર્જર સામે
સેટેલાઈટ, અમદાવાદ.

પિન : 380 015

13 / 8 / 2011

ઉપરના સરનામામાં પિનકોડ છે. આખા ભારતને 1 થી 9ના આંકડામાં વહેંચી દેવાયું છે. દિલ્હીનો આંક - 1 ગુજરાતનો - 3, મહારાષ્ટ્રનો - 4 અહીં પ્રથમ આંક 3 છે. તે બતાવે છે કે પત્ર ગુજરાતમાં મોકલવાનો છે.
તે પછી 80નો આંક તે ગુજરાતનો વિસ્તાર સૂચવે છે.

(2) સંબોધન : સામેની વ્યક્તિ સાથે આપણો સંબંધ કેવો છે તે સંબોધનથી દર્શાવીએ છીએ. દા.ત., વડીલો, દાદા, બા, બાપુજી, મોટાં બહેન, ભાઈ, શિક્ષક વગેરેને 'પૂજ્ય' કે 'આદરણીય' કે 'મુરબ્બી' એવું સંબોધન લખાય છે. સરખી ઉમરનાને 'પ્રિય' કે 'વહાલું' લખાય છે. આપણાથી નાની ઉમરનાને 'ચિરંજીવી' કે 'વહાલું' જેવું સંબોધન લખાય છે.

એવી જ રીતે પત્રને અંતે સંબંધ મુજબ આદર કે વિનયનું ઉદ્ગારવચન મુકાય છે. દા.ત., વડીલોને પ્રગામ કે વંદન. સમાન વચનાને યાદ, શુભેચ્છા, સ્મરણ વગેરે લખાય છે. નાની ઉમરનાને આશીર્વાદ કે આશિષ લખાય છે.

(3) પત્રનું વસ્તુ : આપણે જે હેતુથી પત્ર લખતા હોઈએ, તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે. પત્રનું વસ્તુ સ્પષ્ટતાથી લખવું જોઈએ. જે વીગતો લખી હોય તે યોગ્ય ક્રમમાં લખેલી હોવી જોઈએ. દરેક નવી બાબત માટે નવો ફકરો કરવો જોઈએ. અંગત પત્ર માત્ર માહિતી પૂરતો ન હોવો જોઈએ. જેને પત્ર લખ્યો હોય તેમની સાથે જાણો કે વાત કરતા હોઈએ તેવી નિકટતા આવવી જોઈએ. આપણા ભાવોને પ્રગટ કરવા યોગ્ય શબ્દો કે વાક્યોની પસંદગી કરવી જોઈએ.

(4) અન્ય સમાચાર : જે હેતુથી પત્ર લખ્યો હોય તે પત્રવસ્તુમાં લખાઈ જાય છે. એ સિવાયની કોઈ વિશેષ કે વધારાની વિગત નવા ફકરા સ્વરૂપે લખાવી જોઈએ.

(5) સમાપન : પત્રને અંતે સૌજન્યપૂર્ણ બ્યવહાર સંબંધી પ્રગામ, આભાર જેવા શબ્દો વપરાય છે અને લિખિતંગ મથાળા હેઠળ પત્ર લખનાર પોતાનું નામ લખી પત્ર પૂરો કરે છે.

● અભ્યાસ

1. नीयेना प्रश्नोना उत्तर आपो :

1. પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુ લખશો ?
 2. આપણાથી મોટી બક્ઝિને પત્ર લખતી વખતે કેવું સંબોધન કરીશું ?
 3. અત્યાર સુધી આપણે કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા ?
 4. કચ્છની સીમાઓ શાનાથી વીટળાયેલી છે ?
 5. કચ્છપ્રદેશમાં ફરતાં કેટલો સમય લાગે છે ?
 6. કચ્છની ઉત્તર-પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે ?
 7. ધોળાવીરા ક્યાં આવેલું છે ?

• स्वाध्याय

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

- આ પત્ર કોને સંબોધીને લખાયો છે ?
 - કશ્ચિનું નામ કેવી રીતે પહ્યું ?
 - કશ્ચજિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો.
 - આ પત્રમાં કશ્ચના કયા-કયા સંતકવિનો ઉલ્લેખ થયેલ છે ?
 - પત્ર લખનાર પત્રના અંતે પોતાનું નામ કઈ બાજુ લખે છે ?

2. नीचेना प्रश्नोना उत्तर विचारीने लाखो :

1. કંડલા બંદર વિશે પાંચથી સાત વાક્યો લખો.
 2. દાદા મેકરણ વિશે પાંચ વાક્યો લખો.
 3. કચ્છમાં કયાં-કયાં જોવાલાયક સ્થળો આવેલાં છે ? તે વિશેનો પત્ર તમારા મિત્ર/બહેનપણીને લખો.

3. નીચેનાં સંદેશા વ્યવહારનાં માધ્યમો વિશે ચાર-પાંચ વાક્યો લખો :

- (1) ਫੇਕਸ (2) ਸੇਲਫ਼ਾਨ (3) ਈ-ਮੇਈਲ

4. નીચેનાં જોડકાં યોગ્ય વીગત સાથે જોડો :

અ	બ
1. ખડીર	કુચળનું આધુનિક ગામ
2. ધીણોધર કુંગર	બેટ
3. કાળો કુંગર	ધોરમનાથની તપશ્ચર્યા
4. ભુજિયો કુંગર	ગુરુદાત્તાત્રેયનાં પગલાં
5. ગાંધીધામ	ભુજ શહેર

4. નીચેના શબ્દોને શબ્દકોશના કુમ પ્રમાણે ગોઢવો :

તપશ્ચર્યા, ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, ધીણોધર, સંસ્કૃતિ

6. નીચેના શબ્દોની જોડણી સુધારો :

1. કચછ	-	2. પાકૃતીક	-
3. તીરથ	-	4. પ્રદેસ	-
5. સેત્રપાળ	-	6. લીખીતન	-

● પ્રવૃત્તિ

1. તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો.
2. ટપાલખાતાની વિવિધ ટિકિટોનો સંગ્રહ કરો.
3. સંદેશા-વ્યવહારનાં માધ્યમોનાં ચિત્રો લેગાં કરી તેના વિશે લખો.
4. દિવાળીકાર્ડ અને લગ્નકંકોતરીનો આલબમ બનાવો.